

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April - 2019
INDIRECT TAX LAW - 2 (DSE-3)

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-1 (A) કેન્દ્રીય આબકારી કાયદાનો અર્થ અને ખ્યાલ સમજાવો. (10)
 (B) વર્ણન કરો : માલસામાન અને આબકારી પાત્ર ઉત્પાદક માલસામાન. (10)
 અથવા
- પ્રશ્ન-1 ટૂંકમાં સમજાવો. કેન્દ્રીય આબકારી મુલ્યાંકનનાં નિયમો. (20)
 પ્રશ્ન-2 કેન્દ્રીય આબકારી એટલે શું? તેની પાયાની પ્રક્રિયા સમજાવો. (20)
 અથવા
- પ્રશ્ન-2 (A) વિવરણ કરો. કેન્દ્રીય આબકારી અને નાનાં પાયાનાં ઉદ્યોગો. (SSI/MSMES) (10)
 (B) વિવરણ કરો. કેન્દ્રીય આબકારી અને જોબવર્ક. (10)
- પ્રશ્ન-3 કસ્ટમનાં કાયદાનો અર્થ અને ખ્યાલ સમજાવો. (15)
 અથવા
- પ્રશ્ન-3 કસ્ટમ ડ્યુટીનો અર્થ સમજાવી અને તેનાં લક્ષણો ફાયદા અને ગેરફાયદાનું વર્ણન કરો. (15)
 પ્રશ્ન-4 નોંધ લખો.
 (1) પ્રતિરોધક લાદણ. (એન્ટી ડમ્પીંગ ડ્યુટી) (08)
 (2) રક્ષણાત્મક ડ્યુટી. (સેફગાર્ડ ડ્યુટી) (07)
 અથવા
 (1) આયાત-નિકાસ પ્રક્રિયા. (08)
 (2) માલસામાન કુરીઅર. (લગેજ કુરીઅર) (07)

ENGLISH VERSION

- Que-1 (A) Give the Meaning and concept of central excise law. (10)
 (B) Explain. Goods and Excisable goods manufacture. (10)
 OR
- Que-1 Explain in brief, central Excise valuation rules. (20)
 Que-2 What do you mean central Excise, Explain it's basic procedures. (20)
 OR
- Que-2 (A) Give brief note on central Excise and SSI (MSMEs) (10)
 (B) Give brief note on central Excise and Jobwork. (10)
- Que-3 Give the meaning and concept of custom Law. (15)
 OR
- Que-3 Give the meaning of custom duties and Discribe its features, merits and demerits. (15)
 Que-4 Short note.
 (1) Anti-dumping. (08)
 (2) Safeguard duty. (07)
 OR
 (1) Import-Export procedure. (08)
 (2) Baggage Courier. (07)
